



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૦/૦૭/૨૦૧૯ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૨૧૪/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૫૦ કેસ કરી, ૪૭ વ્યક્તિઓને ઝડપી, ૧૧૮ લીટર દેશી દારૂ, ૨૪૭ બોટલ ઈંગ્લીશ દારૂ, ૪૦ ક્વોટર ઈંગ્લીશ દારૂ, ૦૧ સ્કુટર અને ૦૧ મોટર સાયકલ કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૦૩ કેસ કરી, ૧૦ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૩૬,૩૯૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૨૧૫/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૩૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.હી.૯૩ મુજબ ૦૫ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૧૨૧૬/૧૯

અમરાઇવાડી : જયેશભાઈ ધીરાજીભાઈ દેસાઈ (રહે.વિરલ એપાર્ટમેન્ટ રબારી કોલોની ગેટ-૩ ની સામે અમરાઇવાડી) તા.૧૭/૦૭/૨૦૧૯ ના રોજ અમરાઇવાડી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૫/૦૪/૨૦૧૯ ના રોજ રબારી કોલોની ગેટ-૪ પાસે આવેલ "પટેલ પાન પાર્લર" આગળ આરોપી "ધનશ્યામ ટ્રાવેલ્સ" વાળા ધનંજય ઉર્ફે ધનશ્યામભાઈ ચીનુભાઈ સોની (રહે.સાર્થક સોસાયટી ઘોડાસર) નાએ જયેશભાઈની ઈનોવા ગાડી કિંમત રૂપિયા ૫,૫૦,૦૦૦/- કંપનીમાં ભાડે મુકવાનું કહી ગાડી લઈ નાસી જઈ જયેશભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે . આ ગુનાની તપાસ પો.સ.ઈ. શ્રી એસ.આર.શર્મા ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૧૨૧૭/૧૯

જી.આઇ.ડી.સી. વટવા : કનુભાઈ વિઠ્ઠલભાઈ અલગોતર (રહે.માતૃવાટીકા ફ્લેટ આયોજનનગર ની સામે વિઝોલ જીઆઇડીસી વટવા) એ તા.૧૯/૭/૧૯ નારોજ જી.આઇ.ડી.સી.વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૫/૦૭/૨૦૧૯ રાતના ૮/૩૦ થી તા.૧૬/૦૭/૨૦૧૯ ના કલાક ૫/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનનું તાળુ તોડી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, તીજોરીમાંથી સોના-ચાંદીના દાગીના કિંમત રૂપિયા ૬૬,૬૫૦/- મતાના ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી સી.એમ.રાઠોડ ચલાવે છે.

એરપોર્ટ : અરવિંદભાઈ બાબુભાઈ વર્મા(ઉ.વ.૩૪)(રહે.કર્મ જ્યોતિ સોસાયટી રામેશ્વર સ્કુલ પાસે ઇ.એસ.આઇ.સી ગોગી રોડ વડોદરા) તા.૧૯/૦૭/૨૦૧૯ બપોરના ૩/૦૦ થી ૪/૩૦ વાગ્યા દરમ્યાન ડોમેસ્ટીક એરપોર્ટ આગળ માણસોની ભીડનો લાભ લઈ, કોઈ અજાણી વ્યક્તિ અરવિંદભાઈના ખીસ્સામાંથી રોકડ રૂપિયા ૧,૦૦,૦૦૦/- તેમજ જીતેન્દ્રભાઈ મુળજીભાઈ પટેલ (ઉ.વ.૫૧)(રહે.રેવાભાઈ ટેનામેન્ટ સુરેલીયા રોડ અમરાઈવાડી) ના પેન્ટના ખીસ્સામાંથી રોકડ રૂપિયા ૫૦,૦૦૦/- ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આઇ.વી.વોરા ચલાવે છે.

આત્મહત્યા:-

ઘાટલોડીયા : આનલબહેન નિપુલભાઈ શાહ (ઉ.વ.૩૬)(રહે.સરદાર પટેલ નગર મુખ્યમંત્રી આવાસ યોજના શાસ્ત્રીનગર ત્રણ રસ્તા પાસે ઘાટલોડીયા) એ અગમ્ય કારણસર તા.૧૯/૦૭/૧૯ ના કલાક ૧૨/૪૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે બેડરૂમમાં પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ઘાટલોડીયા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.જે.મકવાણા ચલાવે છે.

આનંદનગર : મહેશભાઈ કેશવલાલ ઠક્કર (ઉ.વ.૩૩)(રહે.ટૂવીકલ રેસીડંસી એમ.વી.ફાર્મસી સામે જોધપુર ગામ આનંદનગર)એ અગમ્ય કારણસર તા.૧૯/૦૭/૧૯ ના કલાક ૧૨/૪૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે બેડરૂમમાં પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ઘાટલોડીયા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.જે.મકવાણા ચલાવે છે.

સરદારનગર : દિપીકાબહેન ડો/ઓ દિપકભાઈ ચૌહાણ(ઉ.વ.૧૫)(રહે.નહેરૂનગરના છાપરા રામાપીરના મંદીરની સામે “એફ” વોર્ડ કુબેરનગર) એ અગમ્ય કારણસર તા.૧૮/૦૭/૧૯ રાતના ૧૧/૧૫ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે સરદારનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એલ.એસ.દેસાઈ ચલાવે છે.

બાપુનગર : શિવરામભાઈ મલ્લપા લુહાર (ઉ.વ.૩૮)(રહે.સોનેરીયાની ચાલી બાપુનગર)એ અગમ્ય કારણસર તા.૧૯/૦૭/૧૯ ના કલાક ૧/૩૦ થી ૯/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરે રસોડામાં સીલીંગની લોખંડની પાઇપ સાથે કપડાનો ટુકડો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે બાપુનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી બી.એસ.દેસાઈ ચલાવે છે.

રામોલ : યોગેન્દ્રસિંહ નરપતસિંહ રાજપુત (ઉ.વ.૩૭)(રહે.ન્યુ રિટાનગર સુરેલીયા અસ્ટેટ પાસે વસ્ત્રાલ રોડ વસ્ત્રાલ) એ અગમ્ય કારણસર તા.૧૫/૦૭/૧૯ બપોરના ૧/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે બાથરૂમ માંથી ક્લીનર લઈને પોતાની જાતે પી લેતા, સારવાર અર્થે તેમને એલ.જી.હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૧૯/૦૭/૧૯ ના કલાક ૬/૩૦ વાગે તેમનું મૃત્યુ નિપજ્યુ હતું. આ અંગે રામોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી ભીખુભાઈ ભલાભાઈ ચલાવે છે.

દાણીલીમડા : ફાઝલ જાકીરમહંમદ માધુપુરાવાળા (ઉ.વ.૫૦)(રહે.છીપા સોસાયટી નગમાનગર દાણીલીમડા) એ અગમ્ય કારણસર તા.૧૯/૦૭/૧૯ સવારના ૯/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પોતાની જાતે એસીડ પી લેતા શરીરે અસર થતા સારવાર અર્થે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૧૯/૦૭/૧૯ બપોરના ૩/૩૦ વાગે ફરજ પરના ડૉ.શ્રી એ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે દાણીલીમડા પોલીસે અકસ્માતમોત નોંધી આ અંગેની તપાસ મસઇ.શ્રી ભુપેન્દ્રસિંહ વિક્રમસિંહ ચલાવે છે

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.